

— A New Light —  
— એક નવો પ્રકાશ —

*A new light shall  
break upon the earth,  
a light of Truth and  
Harmony.*

*with my obsessions*

પૃથ્વી ઉપર એક નવા પ્રકાશનો, સત્ય અને સંવાદિતાના પ્રકાશનો  
આવિર્ભાવ થશે.

મારા આશીર્વાદ સાથે

Mantras of The Mother

શ્રી માતાજીના મંત્રો

24 December 1954

૨૪ ડિસેમ્બર ૧૯૫૪

- શ્રી માતાજી

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. ☎ 0413-2331470

રવાના: દક્ષિણ કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ ☎ ૦૪૧૩-૨૩૩૧૪૭૦ ● December 2021

<https://themothersprosperity.org>



# Prosperity

શ્રી માતાજીની  
સિદ્ધિ-રિદ્ધિ

2021  
DECEMBER  
૧ ડિસેમ્બર, ૨૦૨૧

== Truth and Harmony ==  
== સત્ય અને સંવાદિતા ==

— Be Like a Channel —  
— નહેર જેવા બની રહેવું —

IT is Thy Will that I should be like a channel, always open, always wider, through which Thy forces may pour themselves in abundance on the world. . . . O Lord, let Thy Will be done. Am I not Thy Will and Thy Consciousness in a felicity supreme? . . .

The being grows immeasurably in largeness and becomes vast like the universe.

તારો સંકલ્પ એમ છે કે મારે હમેશાં એક ખુલ્લી, હમેશાં વધુ વિસ્તૃત નહેર સરખા બની રહેવું કે જેમાંથી તારી શક્તિઓ ભરપૂર રીતે આ જગતમાં વરસે ... હે પ્રભુ, તારો સંકલ્પ સિદ્ધ થાયો ! શું હું એક પરમ આનંદમાં તારો સંકલ્પ અને તારી ચેતના નથી ? ...

અને મારું સ્વરૂપ અમેયરૂપે પોતાનો વિસ્તાર કરીને આખા વિશ્વ જેટલું વિશાળ બની રહ્યું છે.

16 October 1914

૧૬ ઓક્ટોબર ૧૯૧૪

- The Mother

— Resplendent in all Things —  
— सर्व वस्तुઓમાં પ્રકાશમાન —

**I**T is Thy sweet joy, O Lord, that fills my heart; it is Thy silent peace that reigns over my mind. All is repose, force, concentration, light and serenity; and all this is without any limit, without any division; is it only the earth or rather the whole universe that lives in me, I do not know; but it is Thou, O Lord, who dwellest in this consciousness and givest it life; it is Thou who seest, knowest, actest. It is Thou alone whom I see everywhere, or rather there is no longer any “I”, all is one and this Oneness is Thou.

Glory to Thee, O Lord, Master of the world, Thou shinest resplendent in all things!

તારો મધુર આનંદ, પ્રભુ, મારા હૃદયને ભરી રહ્યો છે; તારી નીરવ શાંતિ મારા મન ઉપર રાજ્ય કરી રહી છે. સર્વ કાંઈ વિશ્રાંતિરૂપ બની રહ્યું છે, શક્તિ, એકાગ્રતા, પ્રકાશ અને ગાંભીર્ય રૂપ બની રહ્યું છે; અને એ સર્વને કશી મર્યાદા રહી નથી, એમાં કશો વિચ્છેદ નથી. આ તે શું આ પૃથ્વી કે સારુંયે વિશ્વ મારી અંદર આવીને રહેતું થયું છે કે કેમ, એ તો હું જાણતી નથી, પણ આ ચેતનામાં કેવળ તું જ પ્રભુ, આવીને વાસ કરી રહ્યો છે અને એને સજીવન રાખી રહ્યો છે; એમાં જોનાર તે તું જ છે, તું જ જ્ઞાનને પામનારો છે, તું જ કાર્યને કરનારો છે. કેવળ તને જ હું સર્વત્ર જોઈ રહી છું, અથવા કહો કે હવે કોઈ 'હું' જ રહ્યો નથી, સર્વ કાંઈ એક જ રૂપે છે અને એ એકતા તે તું પોતે છે.

વિજય હો તારો, હે પ્રભુ, હે જગતના સ્વામી, સર્વ વસ્તુઓમાં તું પ્રકાશી રહ્યો છે !

10 May 1914

૧૦ મે ૧૯૧૪

- The Mother

— Being With a Dazzling Light —  
— પ્રકાશથી ઝળહળતું સ્વરૂપ —

**O** LORD of Truth, thrice have I implored Thy manifestation invoking Thee with deep fervour.

Then, as always, the whole being made its total submission. At that moment the consciousness perceived the individual being mental, vital and physical, covered all over with dust, and this being lay prostrate before Thee, its forehead touching the earth, dust in the dust, and it cried to Thee, “O Lord, this being made of dust prostrates itself before Thee praying to be consumed with the fire of the Truth that it may henceforth manifest only Thee.” Then Thou saidst to it, “Arise, thou art pure of all that is dust.” And suddenly, in a stroke, all the dust sank from it like a cloak that falls on the earth, and the being appeared erect, always as substantial but resplendent with a dazzling light.

હે સત્યના પ્રભુ, તારા આવિર્ભાવ માટે મેં ઊંડી તીવ્રતાથી તારું આવાહન ત્રણ વાર કર્યું છે.

પછી, હંમેશની જેમ, આખા સ્વરૂપે પોતાનું સમગ્ર સમર્પણ કર્યું. એ ક્ષણે ચેતનાએ જોયું કે વ્યક્તિ-સ્વરૂપ: મન, પ્રાણ અને શરીર, આખુંય ધૂળથી છવાયેલું હતું અને તને દંડવત્ પ્રણામ કરી રહ્યું હતું — એનું કપાળ જમીનને અડતું હતું, ધૂળની સાથે ધૂળ, અને એણે તને પોકાર કર્યો: “હે પ્રભુ, આ ધૂળનું બનેલું સ્વરૂપ તને દંડવત્ પ્રણામ કરે છે અને પ્રાર્થના કરે છે કે સત્યનો અગ્નિ એને સંપૂર્ણપણે ઓગાળી નાખે જેથી એ માત્ર તારો જ આવિર્ભાવ કરે.” અને તે એને કહ્યું, “ઊભું થા, ધૂળમાત્રથી તું મુક્ત થયું છે.” અને એકાએક, એક ક્ષણમાં, કોઈ વસ્ત્ર જમીન ઉપર સરી પડે એમ એ ધૂળનું આવરણ નીચે સરી પડ્યું અને એ સ્વરૂપનું દર્શન થયું, ટટાર, એટલું જ સઘન, પણ આંખને આંજી નાખે એવા પ્રકાશથી ઝળહળતું.

15 February 1915

૧૫ ફેબ્રુઆરી ૧૯૧૫

- The Mother